



ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ, ભરૂચ

જુની કલેક્ટર કચેરી, કણબીવગા, ભરૂચ

ફોન નં.(૦૨૬૪૨)૨૨૨૦૭૫/૨૨૨૦૭૩

Email:ceo.bauda@gmail.com



ક્રમાંક:બૌડા/Z-1/બાંધકામપરવાનગી/ફા.નં.૧૪૭૧-૨૩/સિ.વિ./વશી/૭૯૪ થી ૭૯૭

તા.૦૪/૦૩/૨૦૨૩

બાંધકામ પરવાનગી નં.- ૧૪૩૬

પ્રતિ,

શ્રી ઉમેશભાઈ ભાઈલાલભાઈ પટેલ તથા અન્ય

રહે. ૪૩-૪૪, પાનમ પ્લાઝા,

સ્ટેશન રોડ, ભરૂચ.

વિષય: મોજે.ઝાડેશ્વર, તા.જી.ભરૂચના રે.સ.નં.૫૯/૧ તથા ૬૦, એકત્રીત ક્ષેત્રફળ: ૧૦૨૦૦.૦૦ ચો.મી. પૈકી પ્લોટ વેલીડેશન મુજબ ૮૧૬૦.૦૦ ચો.મી. વાળી જમીનમાં રહેણાકના ફલેટોનું હાઈરાઈઝ બિલ્ડીંગની બાંધકામ પરવાનગી આપવા બાબત.

સંદર્ભ: (૧) આપની તા.૧૩/૦૧/૨૦૨૩ ની અરજી.

(૨) તાલુકા વિકાસ અધિકારીશ્રી, ભરૂચના બીનખેતી હુકમ ક્રમાંક:તા.પ./ભુમી/વશી-એન.એ./રી-પ્લાન/૨૨૪, તા.૩૦/૦૬/૧૯૯૫.

(૩) અત્રેની કચેરીના તા.૦૭/૧૦/૨૦૨૨ના પત્ર ક્રમાંક:બૌડા/Z-1/પ્લોટ વેલીડેશન-ફા.નં.૦૯-૨૨/સિ.વિ./વશી/૩૩૪૦ થી ૩૩૪૩.

(૪) અત્રેની કચેરીના તા.૦૭/૧૦/૨૦૨૨ના પત્ર ક્રમાંક:બૌડા/Z-1/એકત્રીકરણ-ફા.નં.૦૯-૨૨/સિ.વિ./વશી/૩૩૩૯

(૫) એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયાની એન.ઓ.સી. તા.૨૦/૦૧/૨૦૨૨

(૬) પ્રાદેશિક ફાયર ઓફીસર, સુરત દ્વારા પત્ર જાવક નં./અભિપ્રાય નં. ૪૩, તા.૧૮/૦૧/૨૦૨૩ થી આપેલ પ્રોવિઝનલ NOC.



(પાછળ)

મહાશય,

ઉપરોક્ત વિષય અને સંદર્ભ બાબતે મોજે.ઝાડેશ્વર, તા.જી.ભરૂચના રે.સ.નં.૫૯/૧ તથા ૬૦, એકત્રીત ક્ષેત્રફળ: ૧૦૨૦૦.૦૦ ચો.મી. પૈકી પ્લોટ વેલીડેશન મુજબ ૮૧૬૦.૦૦ ચો.મી. વાળી જમીનમાં રહેણાકના ફ્લેટોનું હાઈરાઈઝ બિલ્ડીંગની બાંધકામ પરવાનગી તથા મંજૂર કરવામાં આવેલા નકશા આ સાથે સામેલ છે.

બિડાણ :-

- (૧) બાંધકામ પરવાનગી પત્ર.
- (૨) મંજૂર કરેલા નકશા.



(એન. આર. ધાધલ)
મુખ્ય કારોબારી અધિકારી
ભરૂચ-અકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ,
ભરૂચ.

નકલ રવાના:-

- (૧) કલેક્ટરશ્રી, કલેક્ટર કચેરી, ભરૂચ.
- (૨) ઝાડેશ્વર ગ્રામપંચાયત, ઝાડેશ્વર, ભરૂચ.
- (૩) બાંધકામ પરવાનગી-સિલેક્ટ ફાઈલ



ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ, ભરૂચ

જુની કલેક્ટર કચેરી, કણબીવગા, ભરૂચ

ફોન નં.(૦૨૬૪૨)૨૨૨૦૭૫/૨૨૨૦૭૩

Email:ceo.bauda@gmail.com



બાંધકામ પરવાનગી

(ગુજરાત સંકલિત વિકાસ નિયંત્રણ વિનિયમો-૨૦૧૭ ના નિયમ ૩.૩ ને આધિન)

શ્રી ઉમેશભાઈ ભાઈલાલભાઈ પટેલ તથા અન્ય દ્વારા મોજે.અડેશ્વર, તા.જી.ભરૂચના રે.સ.નં.૫૯/૧ તથા ૬૦, એકત્રીત ક્ષેત્રફળ: ૧૦૨૦૦.૦૦ ચો.મી. પૈકી પ્લોટ વેલીડેશન મુજબ ૮૧૬૦.૦૦ ચો.મી. વાળી જમીનમાં રહેણાકના ફ્લેટોનું હાઈરાઈઝ બિલ્ડિંગના બાંધકામના પ્લાન નીચેના પત્રકમાં દર્શાવ્યા મુજબ છે.

BUILT-UP AREA					
FLOOR	TOWER-A	TOWER-B	TOWER-C	TOWER-D	TOTAL
BASEMENT	5334.98				5334.98
GROUND FLOOR	580.43	1335.54		575.73	2491.70
1 st FLOOR	552.31	552.31	552.31	496.75	2153.68
2 nd FLOOR	552.31	552.31	552.31	496.75	2153.68
3 rd FLOOR	552.31	552.31	552.31	496.75	2153.68
4 th FLOOR	552.31	552.31	552.31	496.75	2153.68
5 th FLOOR	552.31	552.31	552.31	496.75	2153.68
6 th FLOOR	552.31	552.31	552.31	496.75	2153.68
7 th FLOOR	552.31	552.31	552.31	496.75	2153.68
8 th FLOOR	552.31	552.31	552.31	496.75	2153.68
9 th FLOOR	552.31	552.31	552.31	496.75	2153.68
10 th FLOOR	552.31	552.31	552.31	496.75	2153.68
11 th FLOOR	493.78	493.78	493.78	496.75	1978.09
12 th FLOOR	407.22	407.22	407.22	496.75	1718.41
TERRACE FLOOR	68.54	68.54	68.54	62.22	267.84
TOTAL	12408.05	7828.18	6492.64	6598.95	33327.82
COMMON AMENITY	204.18				33532.00
SECURITY CABIN 1 & 2	16.48				33548.48

F.S.I. AREA					
FLOOR	TOWER-A	TOWER-B	TOWER-C	TOWER-D	TOTAL
BASEMENT	0.00				0.00
GROUND FLOOR	189.89	215.59		67.32	472.80
1 st FLOOR	475.07	475.07	475.07	433.82	1859.03
2 nd FLOOR	475.07	475.07	475.07	433.82	1859.03
3 rd FLOOR	475.07	475.07	475.07	433.82	1859.03
4 th FLOOR	475.07	475.07	475.07	433.82	1859.03
5 th FLOOR	475.07	475.07	475.07	433.82	1859.03
6 th FLOOR	475.07	475.07	475.07	433.82	1859.03
7 th FLOOR	475.07	475.07	475.07	433.82	1859.03
8 th FLOOR	475.07	475.07	475.07	433.82	1859.03
9 th FLOOR	475.07	475.07	475.07	433.82	1859.03
10 th FLOOR	475.07	475.07	475.07	433.82	1859.03
11 th FLOOR	368.29	368.29	368.29	433.82	1538.69
12 th FLOOR	329.98	329.98	329.98	433.82	1423.76
TERRACE FLOOR	0.00	0.00	0.00	0.00	0.00
TOTAL	5638.86	5664.56	5448.97	5273.16	22025.55

કુલ બિલ્ટઅપ એરીયા : 33૫૪૮.૪૮ ચો.મી. વાળી જમીનમાં રહેણાકના ફ્લેટોનું ફાઈરાઈઝ બિલ્ડીંગની નીચે જણાવેલી ખાસ શરતોને આધીન રહીને ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ (સને ૧૯૭૬ ના રાષ્ટ્રપતિ અધિનિયમ નં.૨૭) ની કલમ - ૨૯/૧ (૧), ૨૯/૧ (૨), ૨૯(૧) (૩) અથવા ૪૯ (૧) (બી) હેઠળ બાંધકામ પરવાનગી આપવામાં આવે છે.

શરતો :-

- (૧) ગુજરાત સંકલિત વિકાસ નિયંત્રણ વિનિયમો-૨૦૧૭ ના નિયમ ૩.૭.૨ ની જોગવાઈ મુજબ આ વિકાસ પરવાનગી આપ્યા તારીખથી ૧૨ માસ સુધી અમલમાં રહેશે તથા આ હુકમની તારીખથી નિયમોનુસાર મળવાપાત્ર સમયમર્યાદામાં આપેલ મંજૂરી મુજબનું વિકાસ કાર્ય સમયાંતરે રીન્યુઅલ મેળવી પૂર્ણ કરવાનું રહેશે તથા તે અંગેનું સત્તામંડળનું ઓક્યુપન્સી સર્ટીફિકેટ મેળવી લેવાનું રહેશે. તેમ ન કરવામાં આવે તો આપેલ વિકાસ પરવાનગી આપવામાં રદ થયેલી ગણાશે તથા તે અન્વયે ભરેલ સિક્યોરીટી ડીપોઝીટ જપ્ત કરવામાં આવશે.

- (૧૩) ગુજરાત સંકલિત વિકાસ નિયંત્રણ વિનિયમો-૨૦૧૭ ના નિયમ-૧૭.૨.૨ મુજબ વિકાસ સ્ટ્રક્ચરલ ડીઝાઇનના નિયમોમાં ભુકંપ માટેની નેશનલ બિલ્ડીંગ કોડ તથા ઈન્ડિયન સ્ટાન્ડર્ડ સ્પેસીફિકેશનની જોગવાઈઓ મુજબના પ્રમાણપત્રો, સોઇલ ટેસ્ટીંગ, સ્ટ્રક્ચરલ સ્ટેબીલીટીના પ્રમાણપત્રોની સક્ષમ અધિકારીશ્રી પાસે ચકાસણી કરાવી લેવાની રહેશે. તથા સેક્શન-૨ મુજબ આર્કિટેક્ટ/એન્જીનીયર/સ્ટ્રક્ચરલ ડીઝાઇનર/ક્લાર્ક ઓફ વર્ક્સ/ડેવલપર્સ તરફથી ઘટતી કાર્યવાહી કરાવવાની રહેશે. તેમજ બાંધકામના દરેક તબક્કે પ્રોગ્રેસ સર્ટીફિકેટ સક્ષમ અધિકારીશ્રી દ્વારા મેળવી લેવાનું રહેશે. તેમજ બાંધકામ પૂર્ણ થયેથી મકાન વપરાશ પ્રમાણપત્ર પણ સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવી લેવાનું રહેશે.
- (૧૪) સવાલવાળી જમીનનું સોઇલ ટેસ્ટીંગ કરાવી તે મુજબની સ્ટ્રક્ચરલ ડીઝાઇન કરાવવાની રહેશે તથા તે પ્રમાણે સ્ટ્રક્ચરલ એન્જીનીયરશ્રીની દેખરેખ હેઠળ બાંધકામ કરવાનું રહેશે.
- (૧૫) કોમર્શીયલ / રહેણાંકના ત્રણથી ઉપરના માળ અંગે સ્ટ્રક્ચરલ ડીઝાઇન અંગેનો એક સેટ અત્રેની કચેરીએ રજુ કરવાનો રહેશે.
- (૧૬) સદર હું જમીનમાં બિનખેતીનો ઉપયોગ કરતા પહેલા અન્ય કાયદા હેઠળ પરવાનગી લેવાની થતી હોય તો જે તે સંસ્થા પાસેથી તે મેળવી લેવાની રહેશે.
- (૧૭) વિકાસ કામની પરવાનગી સર્વે નંબર/અથવા અંતિમખંડ નંબર અગર પ્લોટમાં અરજદાર જે જમીનમાં માલિક છે તે જમીન પુરતી પરવાનગી આપવામાં આવેલ છે.
- (૧૮) આ પરવાનગીના કારણે
- સદર મિલ્કતમાં પ્રસ્થાપિત થયેલ ઈઝમેન્ટ ઓફ રાઈટસ, માલિકી અંગેની પરવાનગી મળતી નથી.
 - સુચિત બાંધકામ, બાંધકામના માળખાની તથા બાંધકામના માલ સામાનની ગુણવત્તા બાબતેની પરવાનગી મળતી નથી.
 - મિલ્કતની સ્થળસ્થિતિ અને તેના દફતરે નોંધાયેલ ક્ષેત્રફળ તથા સ્થળસ્થિતિના સ્ટ્રક્ચરલ રીપોર્ટ અથવા સ્ટ્રક્ચરલ ડ્રોઈંગ્સ બાબતેની પરવાનગી મળતી નથી.
- (૧૯) વિકાસ નકશાને નગર રચના યોજનાની જુદા જુદા વિસ્તારમાં જમીનો અને મકાનોના ઉપયોગ વિશે જે ખાસ નિયમો હશે તેની વિરુદ્ધનો ઉપયોગ કરી શકાશે નહીં.
- (૨૦) વિકાસ માટેની અંદર બતાવેલી શરતોમાંની કોઈપણ શરતોનો ભંગ કરવામાં આવશે તો શહેરી વિકાસ સત્તામંડળ તે શરતોનો અમલ કરાવી શકશે અને તેના કૃત્યને લીધે જે કાંઈ નુકશાન - ખોટ કે હરકત માલિકને થાય તે બદલ કોઈ પણ બદલો મળી શકશે નહીં.



મંજૂર નંબરમાં બતાવેલી જમીનમાંથી “બૌડા” એ કંઈક જમીન લીધી હશે અગર કોઈ ભાગ તે છોડાવવા હુકમ કરેલો હશે અગર સનદ સિવાયના કોઈ ભાગ “બૌડા” એ કબજો કર્યો હશે તો તે સિવાયના ભાગ માટે વિકાસ પરવાનગી અધિકૃત સનદના માપને આધીન રહીને આપેલ ગણાશે.

- (૨૨) વિકાસ પરવાનગી હાલના સરકારશ્રીના સંકલિત સામાન્ય વિકાસ નિયંત્રણ વિનિયમો-૨૦૧૭ મુજબ વિકાસ પરવાનગી આપવામાં આવી છે અને ખાનગી હક્કોના નુકશાન અંગે સત્તામંડળ કંઈ પણ જવાબદારી લેતી નથી.
- (૨૩) આ વિકાસ પરવાનગી હુકમ સત્તામંડળના અધિકૃત અધિકારી/કર્મચારી જોવા માંગે તો તેમને બતાવવા માલિક બંધાયેલ છે. તે નહીં બતાવશે તો બાંધકામ બંધ કરવા હુકમ કરશે તે મુજબ બંધ કરવું પડશે.
- (૨૪) રસ્તા ઉપર ઇમારતી સામાન અગર પુરણી પ્રથમથી રજા મેળવ્યા સિવાય નાંખવી નહીં. રજાથી નાંખેલ પુરણી વિગેરે વ્યવસ્થિત જોઈતું કોર્ડન કરી ટ્રાફિકને અડચણ ન થાય તેમ નાંખવી.
- (૨૫) જમીન સંપાદન ધારો-૧૯૮૪ ની કલમ-૪ હેઠળ સદર જમીન સંપાદન અંગેનો હુકમ થયેલ હશે તો બાંધકામ શરૂ કરતા અગાઉ મે.કલેક્ટરશ્રી, ભરૂચની મંજૂરી મેળવવાની રહેશે.
- (૨૬) ઉપર જણાવેલી શરતોનો ભંગ કરવા બદલ ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ ની કલમ ૩૫, ૩૬, ૩૭ ની જોગવાઈ મુજબ દંડ તથા જરૂરી પગલાને પાત્ર હશે.
- (૨૭) જો પ્રશ્નવાળી જમીન ઉપર બોજો હશે તો ધિરાણ કરનાર સંસ્થાની શરતો પણ બંધનકર્તા રહેશે.
- (૨૮) સી.જી.ડી.સી.આર.-૨૦૧૭ ના નિયમ-૧૭.૪ ની જોગવાઈ મુજબ કુલ: ૨૦૫ વૃક્ષો નું વાવેતર/ જાળવણી કરવાની રહેશે.
- (૨૯) ગુજરાત ટાઉન પ્લાનીંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ-૧૯૭૬ સિવાયના અન્ય પ્રવર્તમાન કાયદા હેઠળ લેવાની થતી પરવાનગી મેળવી લેવાની રહેશે.
- (૩૦) શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગાંધીનગરના તા.૧૩/૦૫/૨૦૧૦ ના પત્ર ક્રમાંક: પરચ-૧૦૨૦૧૦-૨૨૭૬ થી જણાવ્યા મુજબ બોરવેલ/ટ્યુબવેલમાં નાના બાળકો પડી જવાની દુર્ઘટનાઓ નિવારવા માટે સર્વોચ્ચ અદાલતને નક્કી કરેલ ગાઈડ લાઈન મુજબ તકેદારીના પગલા લેવાના રહેશે.
- (૩૧) સદર પરવાનગી ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ ૧૯૭૬ની કલમ-૧૭(સી)(૧) હેઠળ તા.૨૮/૦૩/૨૦૧૭ જાહેરનામા ક્રમાંક:GH/V/54 of 2017 DVP-202013-4903-L તથા તા.૨૬/૦૫/૨૦૧૭ ના સુધારા હેઠળના જાહેરનામા ક્રમાંક: GH/V/102 of 2017 DVP-202013-4903-L થી મંજૂર કરેલ વિકાસ યોજનાની દરખાસ્ત મુજબ તથા સરકારશ્રીના તા.૦૩/૧૦/૨૦૧૯ના જાહેરનામા ક્રમાંક:GH/V/143 of 2019/EDB-102016-3629-L થી મંજૂર થઈ અમલી બનેલ કોમન જી.ડી.સી.આર. મુજબ આપવામાં આવેલ છે.



- (૩૨) ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ તથા ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ નિયમ-૧૯૭૯ હેઠળ આપવામાં આવેલ વિકાસ પરવાનગીથી કોઈપણ વ્યક્તિ નગર બાંધકામ/વિકાસ કાર્યથી સદર બાંધકામ દરમ્યાન કોઈપણ વ્યક્તિ ને ઈજા અથવા નુકશાન થાય તો તેની સંપૂર્ણ જવાબદારી બાંધકામ કરનાર/માલિક ની રહેશે. તેની કોઈપણ જવાબદારી અત્રેની કચેરીની અથવા સક્ષમ સત્તાધિકારી/કર્મચારી જેને સત્તા સોંપવામાં આવી છે, તેમની રહેશે નહીં.
- (૩૩) સવાલવાળી જમીનમાં એ.જી.ઓડીટ બાબતે કોઈ ક્ષતી જણાશે તથા કોઈ રકમ ભરવાની બાકી રહેશે તો તે રકમની ભરપાઈ કરવા અરજદારશ્રીને બંધનકર્તા રહેશે.
- (૩૪) શહેરી જમીન ટોચ મર્યાદા અને નિયમન અધિનિયમ, ૧૯૮૪ અન્વયે, કોમ્પીટન્ટ ઓથોરીટી પાસેથી જરૂરી ના-વાંધા પ્રમાણપત્ર જરૂર જણાયે મેળવવાની જવાબદારી અરજદારની રહેશે.
- (૩૫) સદરહું જમીનમાં બીનખેતીનો ઉપયોગ કરતાં પહેલા અન્ય કાયદા હેઠળ પરવાનગી લેવાની થતી હોય તો જે તે સંસ્થા પાસે તે મેળવી લેવાની જવાબદારી અરજદારની રહેશે.
- (૩૬) સદરહું જમીનમાં બાંધકામ વિકાસ યોજના/નગર રચનાની યોજનાની દરખાસ્ત અને નિયમો મુજબ કરવાનું રહેશે.
- (૩૭) આ પરવાનગીના કારણે અરજદારની માલિકી તથા જમીનનો હદ, વિસ્તાર તથા ક્ષેત્રફળ અંગેની મંજૂરી મળતી નથી, પરંતુ નિયમોનુસાર બાંધકામ અંગેની મંજૂરી મળે છે.
- (૩૮) વિકાસ નકશા અને નગર રચના યોજનાની જુદા-જુદા વિસ્તારમાં જમીનો અને મકાનોના ઉપયોગ વિશે જે ખાસ નિયમો હશે તેની વિરૂધ્ધનો ઉપયોગ કરી શકાશે નહીં. તેમજ રજા માંગણી વખતે નકશામાં જે ઉપયોગ દર્શાવાયો હશે તેથી જુદો ઉપયોગ અગાઉથી મંજૂરી લીધા સિવાય કરી શકાશે નહીં.
- (૩૯) અરજદારે નિયમાનુસાર ભરવાનો થતો વિકાસ ચાર્જ આપવાનો રહેશે.
- (૪૦) માલિકને વિકાસ માટેની પરવાનગી આપવામાં આવી હશે તો પણ તેમણે ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ મુજબ નગર રચના યોજના માટે ફાળો આપવાનો રહેશે.
- (૪૧) સેપ્ટીક ટેંક તથા સોકવેલની સાઈઝ તથા સંખ્યા નેશન બિલ્ડીંગ કોડ (આઈએસ ૨૪૭૦) તથા જી.ડી.સી.આરના વિનિયમ નં.૧૩.૧૦.૧ મુજબ સીવરેજ ના નિકાલની વ્યવસ્થા કરવાની રહેશે. તે અનુસારની જોગવાઈ કરવાની જવાબદારી આર્કિટેક્ટ/ઈજનેર/સ્ટ્રક્ચરલ એન્જીનીયર/ક્લાર્ક ઓફ વર્ક્સ/સાઈટ સુપર વાઈઝર/ડેવલપર/ જમીન માલિકની રહેશે.
- (૪૨) સુચિત બાંધકામ અંગે ફાયર અંતર્ગત તમામ સુવિધાઓ પુરી પાડવા માટે સરકારશ્રી દ્વારા ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ મેસર્સ એક્ટ-૨૦૧૩ ની જોગવાઈ મુજબ સ્ટેશન ફાયર ઓફીસર, સુરત દ્વારા તા.૧૮/૦૧/૨૦૨૩, ફાયર (અભિપ્રાય) ડા.નં.૪૩ થી જે શરતોને આધીન ફાયર અંતર્ગત NOC આપેલ છે. તેનું પાલન કરવાનું રહેશે.

- (૪૩) જી.ડી.સી.આર.ના વિનિયમ મુજબની તમામ માહિતી સ્થળ ઉપર (નોટીસ બોર્ડ) પ્રસિધ્ધ કરવાની રહેશે.
- (૪૪) તાલુકા વિકાસ અધિકારીશ્રી, ભરૂચના બીનખેતી હુકમ ક્રમાંક:તા.પ./ભુમી/વશી-એન.એ./રી-પ્લાન/૨૨૪, તા.૩૦/૦૬/૧૯૯૫ થી બીનખેતી હુકમ આપેલ છે. તેની તમામ નિર્દિષ્ટ શરતોનું પાલન કરવાનું રહેશે.
- (૪૫) અત્રેની કચેરીએથી સદર જમીનમાં પ્લોટ વેલીડેશન પરવાનગી આપવામાં આવેલ છે. જે મુજબ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ના હેતુ માટે અત્રેને ફાળવેલ જમીન સ્થળે ખુલ્લી રાખવાની રહેશે. જેનો કબ્જો અત્રેને સુપ્રત કરવાનો રહેશે.
- (૪૬) અરજદારશ્રી દ્વારા તા.૨૧/૧૨/૨૦૨૨ ના રોજ રૂ.૩૦૦ સ્ટેમ્પ પેપર ઉપર આપેલ બાંહેધરી મુજબ બાંધકામ અંગે SEIAA દ્વારા Environment Clearance NOC અત્રેની કચેરીમાં રજુ કરી પરવાનગી લઈ બાંધકામ કરવાનું રહેશે.
- (૪૭) ઉપર જણાવેલ કોઈપણ શરતોનો ભંગ કરવામાં આવશે તો પરવાનગી આપોઆપ રદ થયેલી ગણાશે.

બાંધકામ પરવાનગી નં.- ૧૪૩૬

નં.બૌડા/Z-1/બાંધકામપરવાનગી/ફા.નં.૧૪૭૧-૨૩/સિ.વિ./વશી/૭૯૪ થી

ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ, ભરૂચ

તા.૦૪/૦૩/૨૦૨૩



(એન. આર. ધાધલ)
મુખ્ય કારોબારી અધિકારી
ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ,
ભરૂચ.